

ત્વરિત જાહેરાત માટે

## મે 17-23 દરમિયાન યોજાતા નેશનલ પબ્લિક વર્ક્સ વીકને સીટી ઓફ બ્રેમ્પટને માન્ય રાખ્યું

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 19, 2020) – મે 23 સુધી, સીટી ઓફ બ્રેમ્પટને આપણાં સમુદાયમાં સાર્વજનિક કામગીરી કરતા વ્યવસાયિકોની મહત્વની ભૂમિકાને ઉજવવા નેશનલ પબ્લિક વર્ક્સ વીક (NPWW) ને માન્ય રાખ્યું.

આપણાં શહેરની COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં, તેની પબ્લિક વર્ક્સ એન્જનીયરિંગ ટીમે મોખરાની હરોળમાં નિર્ણાયક અને અનિવાર્ય કામ ચાલુ રાખ્યું છે, જેમાં સામેલ છે: સાઈડવોકસ, રસ્તાઓ અને બ્રિજને અનિવાર્ય પ્રવાસ માટે સુરક્ષિત રાખવા બાંધકામ અને નિભાવ-જાળવણી કરવી, સિગ્નલ અને સ્ટ્રીટ લાઈટ સંચાલન, વસંત ઋતુ સંબંધિત સફાઈ કામગીરી, કેચ બેસિનની સફાઈ, અને સ્ટ્રીટ પરથી કચરો હટાવવાની કામગીરી.

પાછલા વર્ષોમાં, જાહેર કામગીરીની સેવાઓ સમુદાયને દરરોજ કેવી રીતે અસર કરે છે તે અંગે જાગૃકતા ફેલવવા સીટી ઓફ બ્રેમ્પટને સમગ્ર અઠવાડિયા દરમિયાન સંખ્યાબંધ મનોરંજક અને આકર્ષક પ્રવૃત્તિઓ સાથે, NPWW ને ઉજવ્યું. આ વર્ષે જ્યારે રૂબરૂમાં કોઈ આયોજનો થવાના નથી ત્યારે, બ્રેમ્પટનને સુરક્ષિત, ચોખ્ખું અને ચલાયમાન રાખવામાં આ વ્યવસાયિકો દ્વારા કરવામાં આવતા મહત્વના કામ વિશે રહેવાસીઓ વધુ માહિતી મેળવે તે માટે સીટી રહેવાસીઓને પ્રોત્સાહિત કરે છે. સમગ્ર અઠવાડિયા દરમિયાન વધુ માહિતી મેળવવા @CityBrampton ને [Twitter](#), [Facebook](#) અને [Instagram](#) પર અનુસરો અથવા વેબસાઈટ જુઓ, [www.brampton.ca](http://www.brampton.ca).

### અવતરણો (ક્વોટ્સ):

“વરસાદી પાણીના સંચાલનથી માંડીને રસ્તાઓ અને બ્રિજના બાંધકામ સુધી, સાર્વજનિક કામગીરી કરતા વ્યવસાયિકો શહેરને, વર્ષભર જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમે તેઓની કામગીરીને આ વર્ષે અમારા વાર્ષિક આયોજનો કરીને ઉજવી શકતા નથી ત્યારે, બ્રેમ્પટનને સુરક્ષિત અને આરોગ્યપ્રદ શહેર બનાવવા તેઓની અથાકપણે મહેનતુ કામગીરી બદલ હું તેઓનો આભાર માનું છું.”

– પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“નેશનલ પબ્લિક વર્ક્સ વીક આપણાં સમુદાયમાં જીવનની ગુણવત્તાને સહાયરૂપ થવામાં પબ્લિક વર્ક્સ દ્વારા કરવામાં આવતી મહત્વની ભૂમિકાને આવકારતું સ્મૃતિપત્ર છે. આ શૂપની મહેનતુ કામગીરી બદલ તેઓના આભારી થતા, આપણાં રહેવાસીઓ સુરક્ષિત રીતે અનિવાર્ય પ્રવાસો કરી શકે છે, તેઓની બાઈક્સ પર સવારી કરી શકે છે અને આ મુશ્કેલભર્યા સમય દરમિયાન પોતાના પાડોશમાં ચાલવા જઈ શકે છે.”

– પૉલ વિસેંટે (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; અધ્યક્ષ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ

“આપણાં સમુદાયને આરોગ્યપ્રદ અને સુરક્ષિત રાખવા ઉપરાંત, અમારી પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ ટીમ બ્રેમ્પટનને હરિયાળુ શહેર બનાવવાની અમારી કટિબદ્ધતાને વળગી રહે છે. સક્રિય પરિવહન પ્રોજેક્ટ્સને સહાયક બનીને જેમ કે અમે નવી શરૂ કરેલી વચગાળાની બાઈક લેનથી માંડીને, પ્રદૂષણ ઘટાડવા ખાસ બરફ-સાફ કરતા સાધનોના ઉપયોગ સુધી, આપણું પર્યાવરણ તેઓની કામગીરીના હાઈમાં રહે છે.”

– પેટ ફોર્ટિની (Pat Fortini), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; ઉપ-પ્રમુખ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ

“વર્ષભર, અમારી પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ ટીમ બ્રેમ્પટનને સુરક્ષિત, સાફ અને ચલાયમાન રાખવામાં અતૂટ ભૂમિકા ભજવે છે. આ નેશનલ પબ્લિક વર્ક્સ વીક પર, હું અમારા સમર્પિત મોખરાના કર્મચારીઓનો આભાર માનું છું જેઓ આપણો સમુદાય નિર્ભર હોય તેવી અનિવાર્ય અને નિર્ણાયક સેવાઓ આપવાનું ચાલુ રાખે છે.”

– ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

**मिडिया संपर्क :**

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्युदात्मक संवाद

सीटी ओफ् ब्रॅम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)